સંસ્કાર દીપ

વર્ષ ૪૨, ડિસેમ્બર-૨૦૧૧, અંક-૧૨,
આજીવન લવાજમ રૂા. ૨૦૦/-

પ.પૂ.ગુરુવર્ય શાસ્ત્રીજી
મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી
તથા
વાત્સલ્યમૂર્તિ પરમ પુજ્ય
સદ્‌ગુરુ પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી

: આશીર્વાદ :
અખંડ ભગવદ્ પરાયણ અ.નિ. પૂ. શ્રી જોગી સ્વામી
: અધ્યક્ષ :
પ.પૂ. સદ્‌ગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી
: પ્રેરણા :
પ.પૂ. સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી
મુદ્રક : સુર્યા ઓફસેટ, આંબલી, અમદાવાદ-૫૮

: તંત્રી :
શ્રી લક્ષ્મણભાઈ આદ્રોજા
: સંપાદક :
શાસ્ત્રી યજ્ઞવલ્લભદાસજી સ્વામી
: કલા સંયોજન :
ગોવિંદ જી. બાંટવા

: પ્રકાશક :
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ
વિદ્યાર્થી સંઘ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ,
મેમનગર, અમદાવાદ - ૩૮૦ ૦૫૨
સંપર્ક : (૦૭૯) ૨૭૯૧૨૫૯૧
૯૮૨૫૨૧૦૦૩૮, ૯૮૨૫૩૧૫૦૩૦
www.swaminarayangurukul.org
E-mail :sgvpgurukul@gmail.com

હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી...

- લક્ષ્મણભાઈ આદ્રોજા

ટુંકા ગાળામાં અનુપમ આદર્શો પ્રસ્થાપિત કરી, જગતના જીવો ઉપર કરુણામૃતનો છંટકાવ કોઈ અવતારે કર્યો હોય તો તે અવતાર છે, **સ્વામિનારાયણ ભગવાન**નો. '**ન્હોતી દીઠી, ન્હોતી સાંભળી**' એવી પુનિત રીત પ્રગટ કરનાર, સ્વાનુભૂતિના સાર રૂપે નંદ સંતોએ પદોમાં ગાઈ છે.

આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી,
મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી.

એવી કાંઈક વિશિષ્ટ અનુપમ, અપૂર્વ, અને અદ્વિતીય પ્રાપ્તિ થઈ, જેના આનંદને વ્યક્ત કર્યા વિના રહી ન શકાયું. તેથી તો કોઈએ એ દિવ્યાનંદને શબ્દોમાં ગૂંથ્યો, કોઈએ શિલ્પ સ્થાપત્યમાં કંડાર્યો, કોઈએ ચિત્રમાં ચિતર્યો, કોઈએ સંગીતના સૂરોમાં વહાવ્યો. કારણ કે એ આનંદમાં નરી કરુણા ભરી હતી. વિના સાધનાએ સિદ્ધ કરી દીધાં. નિર્ભયતાની નોબતું વગાડી, જીતના જંગી ઢોલ વગાડ્યા. કલ્યાણનો ધોરી માર્ગ વહેતો કર્યો. એવી સર્વોપરિ રીત પ્રવર્તાવી કે,

'જે સુખને ભવબ્રહ્મા રે ઈચ્છે...',
' સુગમ થયું આ ટાણે... '

એ મુક્તાનંદ સ્વામી જેવા સંત પુરુષ પ્રાપ્ત થયેલ અસીમ સુખની વાત કરે છે. સત્સંગના આપણા વડવાઓની વાતોમાં અને જીવનમાં વણાયો છે આ આનંદ. તેથી તો સ્વાનુભૂતિની વાત કરીને સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામી આપણને ઈષ્ટદેવમાં અનન્ય ભાવે અનુરાગી થયેલાની સ્થિતિનું ચિત્ર આપે છે.

આજ આવીયો આનંદ અંગ, ઉમંગ ઉરે અતિ, અતિ મળ્યો મોટો સત્સંગ, રંગે રંગાણી મતિ.

સહજાનંદ મળ્યા, સંતો મળ્યા, સત્સંગ મળ્યો, આવી અલૌકિક પ્રાપ્તિ ક્યારે થાય? સંતોએ જ કીર્તનમાં આનો ખુલાસો કર્યો છે.

'પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે,
સ્વામિનારાયણ મળિયા રે ત્યારે.'

સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સંતો-ભક્તોએ જે સુખ માણ્યું તેની જીવનભર વાતો કરતા રહ્યા અને અનેકને એ અલૌકિક સુખના ભોગી બનાવતા રહ્યા. કેવળ નિજ જનને સુખ દેવા મહારાજનું પ્રાગટ્ય થયું છે ત્યારે આપણને એ સુખથી વિરક્ત નહિ રાખે પણ જરુર છે એના થવાની. આજેય એ મૂર્તિના સુખે અહર્નિશ આનંદ-ઉદધિમાં ફરેરા મારતા સંતો-ભક્તોનો આપણને જોગ પણ થતો હોય, પણ એને ઓળખીને જીવ જોડી દઈએ તો આપણેય એ મૂર્તિના અનેરા સુખની અનુભૂતિ કરતા થઈ જઈએ!

નિષ્કુળાનંદ સ્વામીને અનન્ય દૃઢ પ્રતિતિ થઈ ગઈ એટલે ગાઈ ઉઠ્યા-

હવે મારા વ્હાલાને નહિ રે વિસારું,
શ્વાસ ઉચ્છવાસે તે નિત્ય સંભારું.

એમનો વ્હાલો એ જ આપણો વ્હાલો છે. પણ સ્વામી અનેરા ભાવથી ગાય છે, વ્હાલાની પ્રાપ્તિને -

હવે હું તો પૂરણ પદવીને પામી રે,
મળ્યા મને નિષ્કુળાનના સ્વામી રે.

એવા ભાવથી આપણે ગાઈ શકીએ છીએ ખરા? જો ગાઈ શકીએ તો નંદ સંતોના અહોભાવભર્યા શબ્દો આપણા બની જાય. કીર્તનને આપણે ધીમેથી ગાઈએ એ તો સારું જ છે પણ ભાવવાહી વાચન કરીને તે ભાવમાં ભીંજાઈએ તો કીર્તન પણ આપણું બની જશે. પછી આપણે પણ શ્રીહરિના સમકાલીન બની જઈશું.

સંતોએ સુખધામ શ્રીહરિની સંગાથે રાસે રમીને, રંગે ભીંજાઈને, એમના હાથે પ્રેમથી જમીને, બાથે ભેટીને, છાતીએ ચરણારવિંદ લઈને, જે આનંદ લૂટ્યો છે, તેનો અમુલખ વારસો આપણને અપતા ગયા છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પ્રેમમૂર્તિ પુરાણી સ્વામી અને અખંડ ભગવદ્ પરાયણ પૂ. જોગી સ્વામી જેવા સંતોના જોગમાં રહીને આપણે એ દિવ્ય વારસાને સમજી શકવાની યોગ્યતા કેળવી શક્યા છીએ. એટલે નંદ સંતોના આ શબ્દોને આપણા બનાવી, એ જ આનંદ સાથે આપણે પણ ગાતા રહીએ,

આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી.

■ ■ ■

ટૂંકી વાર્તા

મનનાં ઝેર

બને નહિ, પણ બન્યું એવું કે સર્પ અને ઉંદર મિત્ર બન્યા. બન્ને વિચારવા લાગ્યા, 'ઝેર શું છે? ચાલો, આપણે એની શોધ કરીએ.' બન્ને એક મોટી ઘાસની ગંજીમાં સંતાયા.

ખેડૂતે ઘાસ લેવા હાથ નાખ્યો ત્યાં સર્પ ડંખ મારી સંતાઈ ગયો અને ઉંદરે બહાર ડોકિયું કર્યું. ખેડૂત કહે, 'આ તો ઉંદર કરડ્યો!'

બીજે દિવસે ઉંદર કરડી સંતાયો અને સર્પે બહાર મોં કાઢ્યું. ખેડૂતે ચીસ નાખી. 'અરે! સર્પ ડંખ્યો!' અને મૂર્ચ્છિત થઈ ઢળી પડ્યો.

ઝેર સર્પ કે ઉંદરનું નહિ, મનનું છે.

મન માણસને પાપી બનાવે છે અને એ જ માણસને પુણ્યશાળી બનાવે છે.

'જે મન જીતે તે જગતને જીતે.'

ધર્મ ક્યાં છે?

એક ચીસ સંભળાઈ અને રાજમાર્ગ પર ચાલ્યો જતો લેખક ચમકી ગયો. એક હરિજન બાળાના જમણા પગના અંગૂઠે નાગે ડંખ માર્યો હતો. લેખક ત્યાં દોડી ગયો. વિષ બીજા અંગોમાં પ્રસરી ન જાય તે માટે એને કંઈ ન જડતાં પોતાની જનોઈને તોડી એના પગે બાંધી અને ડંખના ભાગ પર ચપ્પુથી કાપ મૂક્યો. વિષમિશ્રિત કાળું લોહી બહાર ધસી આવ્યું. બાળા બચી ગઈ?

આ વાત સાંભળી બ્રાહ્મણો ચમક્યા, જનોઈ ઢેયડીના પગમાં! જોઈ લો, કળિયુગનો પ્રભાવ! નાત ભેગી થઈ. અપરાધીને ધમકાવવા નેતાએ ગર્જના કરી. 'શું છે તારું નામ?' 'મહાવીરપ્રસાદ દ્વિવેદી.' લેખકે ઉત્તર આપતાં સામો પ્રશ્ન કર્યો. 'હું આપને જ પૂછું : જનોઈ પવિત્ર કે અપવિત્ર?' 'પવિત્ર.' 'એક બીજી વાત પૂછું : પ્રાણની રક્ષા કરવાનું કાર્ય પવિત્ર કે અપવિત્ર?' 'એ તો પવિત્ર જ હો ને!' નેતા જરા ઢીલા પડ્યા.

'પવિત્ર જનોઈથી પ્રાણદાનનું પવિત્ર કાર્ય કર્યું એમાં મેં શો અપરાધ કર્યો? આ શબ્દો સાંભળી ઘણા દ્રવી ગયા. જુનવાણીઓની નીદ્રા ઊડી ગઈ. તનથી ભલે નહિ, મનથી સહુ નમી પડ્યા!!!

"માતૃ સંસ્થાનું નિમંત્રણ"

સદ્‌ગુરુ વંદના મહોત્સવ ઉપક્રમે

ગુરુકુલ પરિવાર સ્નેહમિલન

આત્મીય ગુરુબંધુઓ, જય શ્રી સ્વામિનારાયણ.

ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ પ્રવર્તાવેલ ગુરુકુલ પરંપરાના નાતે આપણે સૌ ભગવાન શ્રી સ્વામિનારાયણના સંબંધે પરિવાર તરીકે જોડાયેલા છીએ. પ્રેમમૂર્તિ પૂજ્યપાદ પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીએ આપણને પ્રેમથી સત્સંગના સંસ્કારોથી ભીંજવ્યા છે. અખંડ ભગવદ્ પરાયણ પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીના કૃપા પ્રસાદથી આપણા જીવન ધન્યભાગી બન્યા છે. આ સંતવર્યોના ખોળે ઉછરેલા અને માતૃસંસ્થા ગુરુકુલના યોગમાં આવીને સુખ-સમૃદ્ધિ અને સત્સંગ-સંસ્કારોથી રંગાયેલા ગુરુકુલ પરિવારના સૌ સભ્યોનું સત્સંગ સભર સ્નેહમિલન પરમ પૂજ્ય સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા સદ્‌ગુરુ સંતોના સાનિધ્યમાં તા. ૨૫/૧૨/૨૦૧૧ના રોજ રાખવામાં આવેલ છે, તો આવો આપણે સૌ સાથે મળી માતૃસંસ્થાને ખોળે દિવ્ય સંસ્મરણોને વાગોળીએ...

આપશ્રીને પરિવાર સહિત પધારી સ્નેહમિલનમાં સહભાગી થવા માતૃસંસ્થા વતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું.

– લી. પુરાણી બાલકૃષ્ણદાસના હેતપૂર્વક જય સ્વામિનારાયણ.

નોંધ :- (૧) તા. ૨૫/૧૨/૧૧, રવિવારના રોજ સવારે ૮ થી સાંજે ૮ કલાકે (૨) બહાર ગામથી આવનાર ભક્તો માટે ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવશે.

-: શુભ સ્થળ :-

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP), છારોડી, અમદાવાદ, સંપર્ક : ૯૮૨૫૨૧૦૦૩૮/૯૬

સમાચાર દર્શન

શ્રીમદ્ ભાગવત કથા-હરિદ્વાર

કચ્છ આથમણા સુખપરના અને હાલ વર્ષોથી મોમ્બાસામાં સ્થિર થયેલા કચ્છ સમાજના અગ્રણી અક્ષરનિવાસી હરિભક્ત શ્રી કરશન પ્રેમજી ભુડીયાની પવિત્ર સ્મૃતિમાં, સુરેશભાઇ ભુડીયા અને લલિતભાઇ ભુડીયાના સમસ્ત પરિવાર દ્વારા હરિદ્વાર સપ્તર્ષિ- સ્વામિનારાયણ ઘાટ, ગંગાજીના પુનિત કિનારે પ.પૂ સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસાસને તા. ૧૫ થી ૨૧ ઓક્ટોબર દરમ્યાન શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન થયું હતું.

કથાના પ્રારંભે હરિદ્વારના વિશાળ માર્ગ ઉપર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શણગારેલા રથમાં ઠાકોરજી સાથે કથાના વક્તાશ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા મહામંડલેશ્વર સોહમ્ પીઠાધિપતિ પ્રેમાનંદજી મહારાજ બીરાજમાન થયા હતાં. સાથે હરિદ્વાર – ઋષિકેશથી મોટી સંખ્યામાં સંતો, ભાગવત પોથી મસ્તકે ધારણ કરતી બહેનો વગેરે જોડાયા હતાં. આ સમયે છારોડી ગુરુકુલમાં ગૌશાળાની સેવા કરતાં શાસ્ત્રી માધવચરણદાસજી સ્વામી તથા ગોવિંદપ્રસાદ સ્વામી અમદાવાદ ગુરુકુલથી હરિદ્વાર સુધી પગપાળા યાત્રા પુરી કરી હરિદ્વાર પહોંચતા પ.પૂ સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીસ્વામીના તથા સાથેના અન્ય સંતોના હાથે ગંગાજીમાં પૂજ્ય જોગી સ્વામીનાં અસ્થિ શાસ્ત્રોક્ત વિધિથી વૈદિક મંત્રો સાથે પધરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બદ્રીનાથ કેદારનાથ વગેરે તીર્થસ્થાનોમાં પણ અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા હતાં.આ ઉપરાંત પ.ભ. જીવરામભાઇના માતૃશ્રી દીવાળી બેનના અસ્થિ વિસર્જનનો વિધિ ઋષિકુમારો દ્વારા કરવામાં આવ્યો હતો.

ગંગાજી સ્વચ્છતા અભિયાન :-

ઋષિકેશમાં પરમાર્થ નિકેતન આશ્રમ પાસે વહેતી ભવ્ય ભાગીરથીની આરતીના સમયે પરમાર્થ નિકેતન આશ્રમના અધ્યક્ષ શ્રી ચિદાનંદજી મહારાજ (મુનિજી)એ ઘોષણા તરીકે ગંગાજી સ્વચ્છતા અભિયાન દ્વારા દિપાવલી મહોત્સવ અનોખી રીતે ઉજવીએ. ઋષિકેશમાં પરમાર્થ નિકેતન આશ્રમ પાસે વહેતી ગંગાજીના સ્વચ્છતા અભિયાનમાં પૂ. મુનીજી, પૂ. સદ્‌ગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પૂ. શામજી ભગત, પૂ. કનુ ભગત તથા ઋષિકુમારો પણ જોડાયા હતા. પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતુ કે ખરેખર આ ગંગાજી સ્વચ્છતા અભિયાન દ્વારા ગંગાજીની સાચી પૂજા છે અને જે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યુ છે તે દિપાવલી ઉત્સવ છે. પરમાર્થ નિકેતનના ૧૫૦ જેટલા ઋષિકુમારો પણ આ અભિયાનમાં જોડાયા હતા.

પાર્ષદ રવજી ભગતની શ્રદ્ધાંજલિ સભા :-

તા. ૧૩ નવેમ્બરના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ ખાતે પૂ. રવજી ભગતની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું. પ. પૂ. સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પૂ. સદ્‌ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પૂ. સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પ.પૂ. સદ્‌ગુરુ શ્રીહરિદાસજી સ્વામીએ પૂ. રવજી ભગતનાં સંસ્મરણો યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ ઉપરાંત પૂ. સંતદાસજી સ્વામી (મુંબઇ), પૂ. ધર્મસ્વરૂપદાસજી સ્વામી (વડતાલ) પૂ. ધર્મસ્વરૂપદાસજી સ્વામી (સારંગપુર), પૂ. નીલકંઠ સ્વામી (પીપલાણા), પૂ. રામસ્વામી (ગાંધીનગર ગુરુકુલ), પુરાણી ધર્મપ્રકાશદાસજી સ્વામી (વડોદરા), પૂ. નારાયણસેવાદાસજી સ્વામી (હરિયાળા), શાસ્ત્રી પ્રેમસ્વરૂપદાસજી સ્વામી (બોટાદ), ડૉ. મુકેશ ભગત તથા જૂનિયર કે. લાલ વગેરે સંતો-મહાનુભાવોએ પધારીને ભગતજીની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં.

પુરાણી પ્રેમપ્રકાશ પ્રાથમિક શાળાનું ખાતમૂહુર્ત :-

ગુરુકુલ પરિવારના માતૃસમાન વાત્સલ્યમૂર્તિ પ. પૂ. પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીની જન્મભૂમિ ખડખડ (તાલુકો-વડિયા, જિલ્લો- અમરેલી)માં તા. ૦૩/૧૦/૨૦૧૧ના રોજ પ. પૂ. સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને શુભ સંકલ્પથી પૂ. સદ્‌ગુરુ ભક્તિપ્રકાશદાસજી સ્વામીના વરદ હસ્તે 'પ્રેમપ્રકાશ પ્રાથમિક શાળા'નું ખાતમૂહુર્ત થયું હતું.

આ પ્રસંગે પૂ. સદ્‌ગુરુ પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામી વગેરે સંતો તેમજ વડિયા સ્વામિનારાયણ મંદિરથી પૂ. રામકૃષ્ણદાસજી સ્વામી તથા પૂ. શાસ્ત્રી શ્રી આનંદ સ્વામી પણ પધાર્યા હતા.

'સદ્‌ગુરુ વંદના' મહોત્સવ ઉપક્રમે સત્સંગ વિચરણ :-

સદ્‌ગુરુ વંદના મહોત્સવ ઉપક્રમે અનેક ગામડાઓમાં ભક્તજનો ૧૦૮ કલાકની ધૂન કરી રહ્યા છે. ઊના પાસે અંબાડા ઝોનના ભક્તજનો દ્વારા તા.૪/૧૧/૧૧નાં રોજ ૧૦૮ કલાકની ધૂન સંપન્ન થતા પૂ. કૃષ્ણજીવનદાસજી સ્વામી, પૂ. ભક્તિવેદાંતદાસજી સ્વામી, પૂ. વેદાંતસ્વરૂપદાસજી સ્વામી વગેરે સંતો પધાર્યા હતા. આ ધૂનમાં અંબાડા, વાજડી, વાવરડા, કાંધી, ભાચા, ઉગલા, ભડીયાદર અને મોતીસર વગેરે ગામનાં ભક્તજનો જોડાયા હતા. આ પ્રસંગે રાત્રે અંબાડા મુકામે સ્નેહમિલન તથા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિરાવા, દુધાળા, ધોકડવા, નારીયેળીમોલી, લુવારીમોલી, કાકીડીમોલી, નીંગાળા, ત્રાકુડા, બારમણ, રૂગનાથપુર, પીઠવડી, માંડવધાર વગેરે ગામોમાં પણ સંતો પધાર્યા હતા.

ભારતીય જાદુગર સમ્મેલન :-

અમદાવાદ કર્ણાવતી ક્લબ ખાતે ભારતભરના શ્રેષ્ઠ જાદુગરોનું સંમેલન જાદુ સમ્રાટ કે.લાલના નેતૃત્ત્વ નીચે યોજાયું હતું. તેના ઉદ્‌ઘાટક તરીકે પ.પૂ. સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી રહ્યા હતા. જ્યારે સમાપનમાં પ. પૂ. શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ખાસ હાજરી આપી હતી. દેશ ભરના ૪૫૦ ઉપરાંત જાદુગરો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં જાદુ સમ્રાટ કે. લાલનું અને જુનિયર કે. લાલ હસુભાઇનું પ. પૂ. શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

હરિદ્વાર કથા પ્રસંગે યોજાયેલ પોથીયાત્રામાં ઉપસ્થિત પ. પૂ. સદ્‌ગુરુવર્ય
શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી સાથે સંતો તથા મહાનુભાવો

ઋષિકેશમાં ગંગા સફાઇ અભિયાનમાં પ. પૂ. સદ્‌ગુરુવર્ય
શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પૂ. મુનીજી તથા ઋષિકુમારો

જાદુ સમ્રાટ કે. લાલનું સન્માન કરતા
પરમ પૂજ્ય સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગર અમદાવાદ ખાતે
દીવાળીના દિવસે અન્નકૂટ આરતી દર્શન

હરદાસબાપાની શ્રદ્ધાંજલિ સભા (રાજકોટ)માં
પૂ. સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા સંતો

ખડખડ ગામે નૂતન સ્કૂલના ખાત મૂહુર્તમાં
પૂ. સદ્‌ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી તથા સંતો

"SANSKARDIP"
R.N.I. 15104/68 Permitted to post at Ahd. PSO on 9th of every month. Registered under Postal Reg. No. GAMC-1729/2010-2012 valid up to 31-12-2012 issued by SSP Ahmedabad-9, Licenced to post without Prepayments No. CPMG/GJ/85/10-12/valid upto 31-12-2012

શ્રીમાન, ______________________

____

____

____

If undelivered Please Return to: Shree Swaminarayan Gurukul, Gurukul Road, Memnagar, Ahmedabad-52